

September 05, 2024

To,	To,
The Manager (CRD)	The Manager - Listing Department
BSE Limited	National Stock Exchange of India Ltd
Phiroze Jeejeebhoy Towers,	Exchange Plaza, Plot no. C/1, G Block,
Dalal Street, Fort,	Bandra-Kurla Complex, Bandra (East)
Mumbai - 400 001	Mumbai - 400 051
Scrip Code: 522215	Symbol : HLEGLAS

Newspaper publication of Notice of 33rd Annual General Meeting Sub:

Ref: Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements)

Regulations, 2015

We would like to inform you that, the Company has published on Thursday, the 5th September, 2024, information relating to Annual General Meeting, viz. Notice of 33rd Annual General Meeting (AGM), Book Closure, Record Date, e-voting details and dispatch of Notice & Annual Report, scheduled to be held on Thursday, 26th September, 2024 in newspapers viz., Business Standard (English Edition) and Jai Hind (Gujarati Edition).

We submit herewith copies of the notices published in the above newspapers, pursuant to the Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Thanking you,

Yours faithfully, For HLE Glascoat Limited

ACHAL S. THAKKAR Company Secretary & Compliance Officer

contractual rate, cost, charges, etc Sd/- Authorised Office

State Bank of India - Bhavnaga

PSPCL Punjab State Power Corporation Limited

Regd. Office: PSEB Head Office, The Mall Patiala- 147001 Corporate Identity No. U40109PB2010SGC033813, Website: www.pspcl.in Mobile No. 96461-55525

E-Tender Eng. No. 7611/P-1/EMP-12803

Dy.Chief Engineer/ Headquarter (Procurement Cell-1) GGSSTP Roopnagar invites E-Tender ID No. 2024_POWER_126627_1 for Procurement of Anion Exchange Resin and Cation Exchange Resin

For detailed NIT & Tender Specification please refer to https://eproc.punjab.gov.in from dated 04.09.24/05:00PM onwards.

Note: Corrigendum and addendum, if any will be published online a

https://eproc.punjab.gov.in. 76155/12/3400/2023/37317

बिंक ऑफ़ बड़ौदा Bank of Baroda Ved Road Branch: Shop No.14-19. Silver Stone Arcade Singappore. NOTICE TO BORROWER (UNDER SUB-SECTION (2) OF SECTION 13 OF THE SARFAESI ACT, 2002)

1.MR. LABHUBHAI RAVJIBHAI PALADIYA (Borrower), 2.MRS, BHAVNABEN LABHUBHAI

I.MR. LABHUBHAI HAVJIBHAI PALADITA (BOFTOWER), Z.MRS. BHAVNABEN LABHUBHI PALADIYA (GO-Borrower), 3. MR. AJAYKUMAR LABHUBHAI PALADIYA (GO-Borrower) (A) PLOT NO. 102, SHRUSHTI ROW HOUSE -3, SAYAN ROAD, SURAT, OPP. ABHISHEK RESIDENCY CHORYASI SURAT. (B) PLOT NO.116 SHRUSHTI ROW HOUSE-3 KOSAD SURAT.

or such liability are as under.

Re: Credit facilities with our Ved Road Branch. We refer to our letter No. Retail-00000010571 and 00000010622-LMS, Dated 27.06.2018 conveying sanction of various credit facilities and the terms of sanction. Pursuant to the above sanction you have availed and started utilizing the credit facilities after providing security for the same, as hereinafte stated. The present outstanding in various loan/credit facility accounts and the security interests created the provided by the security of the security of the security interests created the security in the security in the security interests and the security interests and the security in the secur

Nature & type of Facility	Limit	Rate of Interest	0/s as on 18-08-2024	Security agreement with brief description of securities
Baroda Home Loan - Loan A/c No.: 33690 600001300 Baroda Top-up Loan A/C No.: 33690 600001301	Rs.17,25,000/-	10.65%	10.55% 16,74,426.46 + unapplied interest + unserviced interest + legal and other charges other charges 11.50% 11.5	All right, title and interest in the immovable property bearing Plot No. 116 (As per booking plan plot no.: 102), admeasuring area 69.78 Sq. meters along with the construction thereon of "Shrushti Row House Part-3" Situated on the land bearing R.S. No.: 427/1 paiki, 427/2 paiki, 428/1 paiki, Block No. 682 of Village: Kosad, Sub
Total	Rs. 23,15,000/-		Rs. 22,39,977.12 + unapplied interest + unserviced interest + legal and other charges	District: Surat, Dist: Surat. registered through Instrument of deposit of Title Deed Dated 23.07.2018, vide Reg No. 19432 With sub- registrar Katargam, Dist. Surat.

Description of Securities: All right, title and interest in the immovable property bearing Plot No. 116 (As per booking plan plot no.: 102), admeasuring area 69.78 Sq. meters along with the construction threeon of "Shrushif Row House Part.3" Situated on the land bearing R.S. No. 427/1 paikl, 427.94 (as 428/1 paikl, Block No. 682 of Village: Kosad, Sub District: Surat, Dist: Surat.Surrounded by:-East: Plot No.: 103, West: Plot No.: 101North: Plot No.: 117, South: Society Road.

1. In the Document you have acknowledged your liability to the Bank to the tune of Rs. 23,15,000/- as on 27.06.2018 & other bank charges as per bank guidelines. 2. As you are aware, you have committed defaults in payment of installments of above loans/outstanding for the quarter to be ended 08.08.2024. which have fallen due for payment on 10.05.2024 & thereafter. 3. Consequent upon the defaults committed by you, your above credit facility has been classified as non-performing asset on 08.08.2024 in accordance with the Reserve Bank of India directives and guidelines. In spite of our repeated requests and demands you have not repaid the overdue loans including interest thereon. 4. Having regard to your inability to meet your liabilities in respect of the credit facilities duly secured by various securities mentioned in para 1 above, and classification of your account as a nonperforming asset, we hereby give you notice under sub-section (2) of section 13 of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and call upon you to pay in full and discharge your liabilities to the Bank aggregating Rs.22,39,977.12 (Rupees Twenty Two Lakhs Thirty Nine Thousand Nine Hundred Seventy Seven and paise Twelve Only) + unapplied interest + unserviced interest + legal and other charges within 60 days from the date of this notice. We further give you notice that failing payment of the above amount with interest till the date of payment, we shall be free to exercise all or any of the rights under sub-section (4) of section 13 of the said Act, which please note. 5. Please note that, interest will continue to accrue at the rates specified in para 1 above for each credit facility until payment in full. 6.We invite your attention to sub-section 13 of the said Act in terms of which you are barred from transferring any of the secured assets referred to in para 1 above by way of sale, lease or otherwise (other than in the ordinary course of business), without obtaining our prior written conser We may add that non-compliance with the above provision contained in section 13(13) of the said Act, is an offence punishable under section 29 of the Act. 7.We further invite you attention to sub section (8) of section 13 of the said Act in terms of which you may redeem the secured assets, if the amount of dues together with all costs, charges and expenses incurred by the Bank is tendered by you, at any times before the date of publication of notice for public auction /inviting quotation / tender /private treaty. Please note that after publication of the notice as above, your right to redeem the secured assets will not be available." 8 Please note that this demand notice is without prejudice to and shall not be construed as waiver of any other rights or remedies which we may have, including without limitation, the right to make further demands in respect of sums owing to us.

MANGALAM INDUSTRIAL FINANCE LIMITED

Authorised Officer, Bank of Baroda. Ved Road Brnch, Surat

Date 20.08.2024 | Place Surat

Regd. Off.: Old Nimta Road, Nandan Nagar, Belghoria, Kolkata-700083, WB, India Corp. Off.: Hall No.-1, M R Icon, Next To Milestone Vasna Bhayli Road, Vadodara-391410, Gujarat, India, Tel: +917203948909 Email: compliance@miflindia.com; Website: www.miflindia.com

INFORMATION PERTAINING TO COMPLETION OF DISPATCH OF 41st ANNUAL GENERAL MEETING OF MANGALAM INDUSTRIAL FINANCE LIMITED TO BE HELD THROUGH VIDEO CONFERENCING (VC) / OTHER AUDIO VISUAL MEANS (OAVM) AND EVOTING INFORMATION

Pursuant to the provisions of the Companies Act, 2013 and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015: Notice is hereby given that: 1) The 41st Annual General Meeting (AGM) of the Members of Mangalam Industria

01:00 P.M. (IST) through VIDEO CONFERENCING ("VC") / OTHER AUDIO VISUAL MEANS ("OAVM").

 The Company has sent the Notice of AGM / Annual Report on Wednesday, 04th September, 2024 to those Shareholders holding Shares of the Company as on Friday September, 2024 to those Shareholders holding Shares of the Company as on Friday, 30th August, 2024, through e-mail whose e-mail addresses are registered with the Registrar and Share Transfer Agent (RTA) / Depositories Participants (DP) in accordance with the Circular No. 14/2020 issued by the Ministry of Corporate Affairs dated 8th April, 2020 read with Circular No. 17/2020 dated 13th April, 2020, Circular No. 20/2020 dated 5th May, 2020 and subsequent circulars issued in this regard, the latest being Circular No. 90/2023 dated 25th September, 2023 ("MCA Circulars") and Securities and Exchange Board of India ("SEBI") Circulars dated 12th May, 2020, 15th January, 2021, 13th May, 2022, 5th January 2023 and 7th October 2023.

3) The 41st AGM Notice along with the explanatory statement and the Annual Report for the Financial year 2023-24 is available and can be downloaded from the Company's website www.miflindia.com, BSE Limited website at www.bseindia.com, and on the website of Purva Sharegistry (India) Pvt. Ltd., RTA of the Company, appointed for conducting Remote e-voting, e-voting during the process of AGM and VC at https://evoting.purvashare.com/.

4) Members can attend and participate in the Annual General Meeting through VC / OAVN facility only. The instructions for joining the AGM are provided in the Notice of the AGM Members attending the meeting through VC / OAVM shall be counted for the purposes or reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

5) In compliance with Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration), Rules, 2014 as amended from time to time and Regulation 44 of the SEBI (LODR) Regulations, 2015, the Members are provided with the facility to cast their votes on all resolutions as set forth in the Notice of the AGM using remote electronic voting system ('remote e-voting') provided byPurva Sharegistry (India, Pvt. Ltd., RTA of the Company, Additionally, the Company is also providing the facility of voting by electronic means during the AGM ("e-voting during the AGM"). Detailed procedure for remote e-voting / voting during the AGM is provided in the Notice of TrAA has also a Practicing Company, Secretary (Membership No. 3777A). 6) Mr. Kamal A Lalani, a Practicing Company Secretary (Membership No. 37774), has been appointed as "Scrutinizer" at Meeting of Board of Directors held on 31st August, 2024 to scrutinize the e-voting process and voting at the AGM in a fair and transparent manner. Y) Members are requested to carefully read the instructions given for voting in the AGN Notice. Members are also requested to note the following

Particulars	Details
Date of completion of dispatch of Notice/Annual Report by E-mail	Wednesday, 04th September, 2024
Date and time of Commencement of remote e-voting period	Wednesday, 25th September, 2024 at 09:00 A.M. onwards
Date and time of End of remote e-voting period	Friday, 27th September, 2024 at 05:00 P.M.
Cut-off date for determining the members eligibility for e-voting / remote e-voting	Saturday, 21st September, 2024

The remote e-voting module shall be disabled by Purva Sharegistry (India) Pvt. Ltc

3) Members attending the AGM who have not cast their vote by remote e-voting shall be eligible to cast their vote through e-voting during the AGM. Members who have voted through remote e-voting shall be eligible to attend the AGM, however they shall not be ligible to vote at the meeting. 9) A Person whose name is recorded in the Register of Members or in the Register

peneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting or e-voting at the AGM. The voting rights o Members shall be in proportion to the Shares held by them in the paid-up Equity Shares Capital of the Company as on the cut-off date i.e. Saturday, 21st September, 2024 10) Any person, who acquires Shares of the Company and becomes a Member of the Company, after the Notice has been sent electronically by the Company and holds Share

as of the cut-off date, may obtain the login id and password by sending a request

evoting@purvashare.com.

11) Pursuant to Section 91 & other applicable provisions of the Companies Act, 2013 and in accordance with the Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer Book of the Company shall remain closed from Friday, 20th September, 2024 to Saturday, 28th September, 2024 (both days inclusive) for taking record of the Members of the Company for the purpose of ensuing 41st Annual General Meeting.

12) For details regarding attending AGM & e-voting from the e-voting System, you can write an email to evoting@purvashare.com or contact at 022-49614132 and 022-49700138. All grievances connected with the facility for voting by electronic means may be addressed to Ms. Deepali Dhuri, Compliance Officer, Purva Sharegistry (India) Private Limited, Unit No. 9, Shiv Shakti Industrial Estate, J. R. Boricha Marg, Lower Parel (East), Mumbai - 400011 or send an email to evoting@purvashare.com or contact at 022-022-

Mumbai - 400011 or send an email to evoting@purvashare.com or contact at 022-022 49614132 and 022-49700138.

Shareholders may please note that in terms of aforementioned circulars, th Company will not send physical copies of AGM Notice to the Shareholders.

Place : Vadodara

Date: 05th September, 2024

By order of the Board of Directo

CS Samoil Lokhandwal Company Secretary and Compliance Office **OICICI Bank** Branch Office: ICICI Bank Limited, 1st Floor, Geet Prabha Building, Near Nirmal Hospital Cross Road, Opp. Civil Hospital, Ring Road, Surat- 395002

PUBLIC NOTICE-TENDER CUM E-AUCTION FOR SALE OF SECURED ASSET

[See proviso to Rule 8(6)] Notice for sale of immovable asset(s)

E-Auction Sale Notice for the sale of immovable asset(s) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

This notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged/ charged to the Secured Creditor, the Physical possession of which has been taken by the Authorised Officer of ICICI Bank Limited will be sold on 'As is where is', 'As is what is' and 'Whatever there is' as per the brief particulars given hereunder;

Sr. No.	Name of Borrower(s)/ Co-Borrowers/ Guarantors/ Loan Account No.	Details of the Secured asset(s) with known encumbrances, if any	Amount Outstanding	Reserve Price Earnest Money Deposit	Date and Time of Property Inspection	Date & Time of E-Auction
(A)	(B)	(C)	(D)	(E)	(F)	(G)
1.	(Co- Borrowers) Loan A/c No.	Property-1: Shop No.215, 2nd Floor, Shyam Arcade, Near Modi Hospital, Kakodara,Tal: Palsana, Dist.: Surat- 395010. Block No. 66/Paiki 1 to 5, Admeasuring Super Built up area 1613 Sq. Ft. & Builtup Area 85.99 Sq Mt. Free Hold Property.	Rs.	Rs. 16,90, 000/- Rs. 1,69, 000/-	Rs. 16,90, 03:00 PM From 10,690, 04:00 PM Noon	25, 2024 From 12:00
	LBSUR00005129169/ LBSUR00005307725	Property-2: Shop No.216, 2nd Floor, Shyam Arcade, Near Modi Hospital, Kadodara, Chokdi, Bardoli Road, at: Kadodara, Tal: Palsana, Dist.: Surat- 395010. Block No.66/Paiki 1 to 5, Admeasuring Super Built up area 670 Sq. Ft. Builtup Area 35.34 Sq Mt.Free Hold Property.				

The online auction will be conducted on the website (URL Link-https://disposalhub.com). of our auction agency M/s NexXen Solutions Private Limited. The Mortgagors/ Noticees are given a last chance to pay the total dues with further interest by September 24, 2024 before 04:00 PM else the secured asset(s) will be sold as per schedule. The prospective bidder(s) must submit the Earnest Money Deposit (EMD) Demand Draft (DD) (Refer Column E) at ICICI Bank Limited, 1st Floor, Geet Prabha Building, Near Nirmal Hospital Cross Road, Opp. Civil Hospital, Ring Road, Surat-395002 on or before September 24, 2024 before 04:30 PM Thereafter, they have to submit their offer through the website mentioned above on or before September 24, 2024 before 05:00 PM along with the scanned image of the Bank acknowledged DD towards proof of payment of EMD. In case the prospective bidder(s) is/are unable to submit his/ her/ their offer through the website, then the signed copy of tender documents may be submitted at ICICI Bank Limited, 1st Floor, Geet Prabha Building, Near Nirmal Hospital Cross Road, Opp. Civil Hospital, Ring Road, Surat-395002 on or before September 24, 2024 before 05:00 PM. Earnest Money Deposit DD/PO should be from a Nationalised/ Scheduled Bank in favour of 'ICICI Bank Limited' payable at Surat. For any further clarifications in terms of inspection, Terms and Conditions of the E-Auction or submission of tenders, contact ICICI Bank Employee Phone No. 7304914237/9425815565.
Please note that the Marketing agencies 1. M/s NexXen Solutions Private Limited, 2. Augeo Assets Management Private Limited 3. Cardekho.com 4. Hecta Proptech Private Limited. have also been engaged for facilitating the sale of this property.
The Authorised Officer reserves the right to reject any or all the bids without furnishing any further reasons. For detailed Terms and Conditions of the sale, please visit www.icicibank.com/n4p4s

Date : September 05, 2024 Place : Surat Authorized Officer ICICI Bank Limited

Aadhar Housing Finance Ltd.

Corporate Office: Unit No. 802, Natraj Rustomjee, Western Express Highway and M.V. Road, Andheri (East), Mumbai - 400069.

Surat Parvat Patiya Branch: Shop No.312&313, Times Galleria, Nr Saroli Village Gate, Opp Kuberji World Textile Market, Surat Kadodara Road, Surat-395010, GJ

Surat Branch: Office No. 209 & 210, 2nd Floor, Universal Business Center, Near Madhuvan Circle, L.P. Savani Road Adaian, Surat-395009 GJ

APPENDIX IV **POSSESSION NOTICE** (for immovable property)

Whereas, the undersigned being the Authorized Officer of Aadhar Housing Finance Limited (AHFL) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, Demand Notice(s) issued by the Authorised Officer of the company to the Borrower(s) / Guarantor(s) mentioned herein below to repay the amount mentioned in the notice within **60 days** from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower(s) / Guarantor(s) and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of the Section 13 of the said Act read with Rule 8 of the Security Interest Enforcement rules, 2002. The borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of AHFL for an amount as mentioned herein under with interest thereon

Sr. No		Description of Secured Asset (Immovable Property)	Demand Notice Date & Amount	Date of Possession
1	(Loan Code No.12300001612/ Surat Parvat Patiya Branch) Javed Pinjara (Borrower) Yasmin Ben Pinjara (Co-borrower)	All That Part & Parcel of Property Bearing, RS No 68 81 Block No 52-A, Sahkar Township, Flat No 101, 1St Floor Sahkar Township A, Typepaikeea 2, Building B S Bharat Motors Nr Amboli Char Rasta Amboli, Surat, Gujarat , 394185. Boundaries : East: Passage, Stair & Flat No. 104/Adj.N.H.8, West: Open Space/ Adj.Block No. 40, North: Flat No. 102/Adj.Kathor Village Simado, South: Road/Adj.Block No. 42 & 52/B	13-05-2024 ₹ 5,27,029/-	03-09-2024
2	(Loan Code No.04200001085/ Surat Branch) Vijay Verma (Borrower) Dayaram Varma Mori (Co-borrowers), Ramjeet Bechu Rajbhar (Guarantor)	All That Part & Parcel of Property Bearing, Block No 121 Flat No 305, 3rd Floor, Ashirwad Complex Vallabhnagar Soci., Opp Blue Dale School BS Sai Shraddha Resi Vareli Surat, Gujarat-394327 Boundaries : East: Passage & Then Flat No. 312, West: Society Road, North: Flat No. 304, South: Flat No. 306	10-06-2024 ₹ 6,35,383/-	03-09-2024
3	(Loan Code No.12300001695/ Surat Parvat Patiya Branch) Mo Sajid Chhowala (Borrower) Fatema Bibi Chhowala (Co-borrower)	All That Part & Parcel of Property Bearing, House No.1, 3014, 2nd Floor Ward No.1, Nondh No.3014, Badekha Chakla, Opp Khawaja Dana Dargah, Khawaja Dana Dargah Road Gopipura, Surat, Gujarat, 395002 Boundaries : East: Nondh No.3015 Property, West: Nondh No.3012 Property, North: Road, South: Other property	10-06-2024 ₹ 3,50,004/-	03-09-2024

Place : Guiarat Authorised Officer Date : 05.09.2024 **Aadhar Housing Finance Limited**



Indian Overseas Bank - Samroli (2241) Branch Shop No. 1,2,3 & 5, Devarshi Apartment, Old Valsad Road, Village-Samroli, Taluka- Chikhli, Dist.- Navsari, Gujarat-396521.Tel.:- 02634-231266, Email - iob2241@iob.in

(APPENDIX IV) POSSESSION NOTICE - (for immovable property) [(Rule 8(1)]

/hereas, The undersigned being the Authorised Officer of the Indian Overseas Bank having Branch at Shop No. 1/2/3 & 5 Devarshi Apartment, Old Valsad Road, Village-Samroli, Taluka-Chikhli, Dist.-Navsari, Gujarat-396521 under the itisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 20/09/2023 calling upon the borrowers/mortgagor Mr. Rajeshkumar J. Kansara and Mrs. Kashmira Rajesh Kansara Borrower/Mortgagor to repay the amount mentioned in the notice being Rs. 9.81.910.42 (Rupees Nine Lakhs Eighty-One Thousand Nine Hundred Ten and Paise Forty Two only) as on 13/09/2023 with further interest @ 11.45% - Applicable rate and rests as agreed from the date mentioned above, within 60 days from the date of this notice other expenses, charges etc

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrower/Mortgagor/Guarantor and the public is general that the undersigned as per The Honourable Chikhli CJM Order No.: 384/2024 Dated: 06.06.2024 has taken Physical Possession of the property described herein below in exercise of powers conferred on him/ her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on this **01st Day of September of the year 2024**.

The Borrower, Co-Borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and an dealings with the property will be subject to the charge of Indian Overseas Bank having Branch at Samroli for an amount of Rs. 9,81,910.42 (Rupees Nine Lakhs Eighty-One Thousand Nine Hundred Ten and Paise Forty Two only) as or 13/09/2023 with interest @11.45% Applicable rate and rests as agreed & other bank & incidental charges the The above named borrower has also availed following credit facilities from our bank as per details below. The bank is having right of lien for residual amount from the sale of property mentioned herein.

Sr. No.	Nature of facility	Limit	Rates of Interest (including overdue interest) & rests	Total dues* as on date 04/01/2024 (In Rs.)
1.	1. Vehicle Loan Rs. (224103452000067) Rs.		1 Year RLLR + 3.20% = 12.55 % p. a. with monthly rests. (At present 1 Year RLLR is 9.35%)	Rs. 81,780/- (Rupees Eighty One Thousand Seven Hundred Eighty Only)
2.	Mudra Loan (TL) (224103710000031)	Rs. 4,00,000	1 Year RLLR + 1.80% = 11.15% p. a. with monthly rests. (At present 1 Year RLLR is 9.35%)	Rs. 2,41,071.72 (Rupees Two Lakhs Forty One Thousand Seventy One and paisa Seventy Two only)
3.	GECL (224103510000012)	Rs. 80,000	1 Year RLLR - 0.10% = 9.25 % p. a. with monthly rests. (At present 1 Year RLLR is 9.35%)	Rs.16,053/- + Rs.14,801/-* Total Rs.30,854/- (Rupees Thirty Thousand Eight Hundred Fifty Four Only)
4.	GECL (224103510000024)	Rs. 45,000	1 Year RLLR - 0.10% = 9.25 % p. a. with monthly rests. (At present 1 Year RLLR is 9.35%)	Rs.22,249.18 + Rs.20,692/-* Total Rs. 42,941.18 (Rupees Forty Two Thousand Nine Hundred Forty One and

Note: 1. Additional penal interest of 2 % is applicable for the overdue amount. *NCGTC Guarantee Claim Received

With further interest at contractual rates/rests will become payable from the date mentioned above till date of

The borrower's attention is invited to provisions of Sub-section (8) of the Section 13 of the Act, in respect of time available to them, to redeem the secured assets

DESCRIPTION OF IMMOVABLE PROPERTY

All that part and parcel of the property consisting of Immovable property of Residential Residential Flat No.-202. Gram Panchayat House No.-2469/8, 2nd Floor, "Rudraksh Residency", City Survey No.-2063/B, Juna Valsad Road, Village Chikhli, Taluka-Chikhli, Dist.- Navsari, Gujarat-396521(Admeasuring 63.50 Sq. Mtrs. Or 683.26 Sq. Ft., Builtup Area) in the name of Mr. Rajesh Jayantilal Kansara and Mrs. Kashmira Rajesh Kansara (Sale Deed Doc. No. 995/2022 Dated 10/05/2022) Boundaries: East: Adjoining Flat No.-201, West: Open Margin/Then Kaveri Complex, North: Mair Entrance/Passage/Flat No.-203, South: Open Margin/Then Others Property.

Date: 01.09.2024 Authorised Officer Indian Overseas Bank



State Bank of India Stressed Assets Recovery Branch (SARB), 1st Floor, Ratna Artemus, 42, Sardar Patel Nagar, Nr Girish Cold Drinks Cross Road, Off C.G. Road, Ellisbridge, Ahmedabad - 380006 Publication of Notice regarding Possession of Property u/s 13(4) of

SARFAESI Act 2002 Notice is hereby given under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 o 2002) and in exercise of powers conferred under section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, a demar

notice was issued on the dates mentioned against below mentioned account(s) and stated hereinafter calling upon them to repay the amour within 60 days from the date of receipt of said notice whithin our days indire date of the eleption said indires.

The Borrower / Guarantor's having failed to repay the amount, notice is hereby given to the Borrower / Guarantor's and the public in genera that the undersigned has taken symbolic possession of the property(ies) described herein below in exercise of power conferred on him / her

under section 13(4) of the said Act read with 8 of the said Act on the dates mentioned against each account(s).

The Borrower / Guarantor's in particular and the public in general is hereby cautioned not to deal with the property(ies) and any dealings with the property(ies) will be subject to the charge of the **State Bank of India** for the amount outstanding as mentioned below with further interest, incidental expenses, cost, charges, etc.

The Borrowers attention is invited to provisions of Sub-section (8) of Section 13 of the Act, in respect of time available to redeem the

Name of Account/ Borrower/ Proprietor/ Partner	Name of Guarantors/ Owner of property etc	Description of the property mortgaged/ charged	Date of Demand Notice Date of Possession Type of Possession	Amount Outstanding as per Demand Notice
Mr. Sevantibhai Shankarbhai Panchal & Mrs. Nayanaben	Mr. Sevantibhai Shankarbhai Panchal & Mrs. Nayanaben	Bungalow No: 23 – Sun Villas, Survey No. 27,30,79, Fp No. 8,10,49, Tps No. 117, Admeasuring Area 108.92 Sg. Mtrs., Mouje –	20-03-2024	Rs. 83,76,266.78 (Rupees eighty three lakh seventy six
Sewantibhai Panchal	Sewantibhai Panchal (Both Mortgagor)	Vastral, Taluka – Vatva, Ahmedabad East : Bunglow No. 22 West : Bunglow No. 24	31-08-2024	thousand two hundred sixty-six and paise
	(Both Mortgagor)	South: Margin Space North: Society	(Symbolic Possession)	seventy eight only) as on 19.03.2024 with further interest at contractual rate, cost, charges, etc
M/s. J. K. Engineering (Partnership firm) Mr. Sevantibhai	Mr. Sevantibhai Shankarbhai Panchal & Mrs. Nayanaben Sewantibhai Panchal (Both Guarantor &	Bungalow No: 23 – Sun Villas, Survey No. 27,30,79, Fp No. 8,10,49, Tps No. 117, Admeasuring Area 108,92 Sq. Mtrs., Mouje – Vastral, Taluka – Vatva, Ahmedabad East: Bunglow No. 22 West: Bunglow No. 24 South: Margin Space North: Society	20-05-2024	Rs. 2,17,67,550.36 (Rupees Two Crore Seventeen Lakh Sixty-
Shankarbhai Panchal (Partner) &			31-08-2024	seven Thousand Five Hundred Fifty and Paise
Mrs. Nayanaben Sewantibhai Panchal (Partner)	Mortgagor)		(Symbolic Possession)	Thirty-six only) as on 20.05.2024 with further interest at contractual rate, cost, charges, etc
M/s Dwarkesh Petrolium (Proprietory Firm),	Mr. Raghavjibhai Valjibhai Prajapati	Immovable property at New Survey No 621 Block No. 3 admeasuring 0-29-50 paikee house No. 4, N.A. land paikee, admeasuring	23-05-2024	Rs. 64,26,708.94 (Rupees Sixty-four Lakh Twenty-six Thousand
Smt. Hansaben Hasmukhbhai Prajapati (Proprietor)	(guarantor & Mortgagor)	75.0 Sq. yard at Jogeshwari Co Operative Housing Society Ltd. At Maflipur Taluka	02-09-2024	Seven Hundred Eight and Paise Ninty-four
, ajapan (i Toprictor)		Dholka Dist Ahmedabad and bounded as under: EAST : Margin Land WEST :Tenament	(Symbolic	only) as on 23.05.2024 with further interest at

TMB CIN - L65110TN1921PLC001908

Date: 05/09/2024

Date: 03.09.2024

Tamilnad Mercantile Bank Limited Ringroad Branch

Plot No.25/C, 25/D,& 25/E Ground Floor, Animesh House, Kinnary Cinemas, Ring road Branch Surat - 395002, Gujarat Email:-surat_ringroad@tmbank.in, Phone No.0261- 2366500, 2367600

Auction Notice for Sale of Immovable Properties

Auction Sale Notice for Sale of Immovable Assets mortgaged / charged to the Bank under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provison to Rule 8 (6) and 9 (1) of the Security Interest (Enforcement) Rules, 2002.

No. 3 SOUTH: Margin Land NORTH: Way of

Notice is hereby given to the public in general and in particular to the Borrower that the below described immovable properties mortgaged to the Secured Creditor, the Physical Possession of which has been taken by the Authorised Officer of Tamilnad Mercantile Bank Limited, Ringroad Branch on 04.12.2022, will be sold "As is where is" "As is what is", and "Whatever there is" on 20.09.2024 for recovery of Rs.2,26,32,452.09 (Rupees Two Crore Twenty Six Lakh Thirty Two Thousand Four Hundred Fifty Two and Paise Nine Only) (Cash Credit for Rs.1,94,29,196.98 and Term Loan-GECL for Rs.26,25,642.00 and Exp - Rs 5,77,613.11} as on 31.07.2024 due to the Tamilnad Mercantile Bank Limited, Ringroad Branch from the Borrower M/s. Raj Shree Industries and it's Proprietor: Mr.Ramnarayan Ambalal Tailor, S/o. Ambalal Tailor and Guarantor(s) 1. Mr.Bherudan Sampatmal Parakh, S/o. Sampatmal Parakah and 2.Mr. Vaishnav Nathudas Laxmandas, S/o. Laxmandas H Vaishnav with subsequent interest and expenses

For Property No:1 The Reserve Price will be Rs. 49,10,000/- and the Earnest Money Deposit will be Rs.4.91.000/-

Property-2 The Reserve Price will be Rs. 49,10,000/- and the Earnest Money Deposit will be Rs. 4,91,000

	Place of Auction	Tamilnad Mercantile Bank Ltd., Ringroad Branch Plot No.25/C, 25/D,& 25/E Ground Floor, Animesh house, Kinnary Cinemas, Ringroad Branch, Surat - 395002, Gujarat, email:-surat_ringroad@tmbank.in, Phone No.0261- 2366500, 2367600
ı	Date and Time of Auction Sale	20.09.2024 i. Property 1 - 03.00 PM, ii.Property 2 - 03.30 PM
I	Upset Price	Property No. 1: Rs. 49,10,000/-, Property No. 2: Rs. 49,10,000/-

Undivided proportionate share in land and building constructed to the extent of 25.33 sq.mt or 272.50 sq. ft carpet area and 27.11 sq.mt or 291.70 sq.ft Buildup area and 50.65 sq.mt or 545 sq.ft super builtup area with 6.84 sq.mt share in land bearing shop no. G-38, situated at R.S No.580/1, 592/1, 593, 595, Block No.631, 671/B, T.P.S.No.12(Puna), F.P.No.24/1, 24/2 & 45/2, International Fashion Market, Ground Floor, Opp. Raj Mahal A/C Mall, Punagam Road, Puna, Tal. Surat City, Dist. Surat standing in the name of Mr.Ramnarayan Ambalal Tailor. Boundaries: North of: Passage and open Space, South of: O.T.S, East of: Shop No.G-39 West of: Staircase and Shop No.G-37

Brief Description of the Properties

Undivided proportionate share in land and building constructed to the extent of 25.33 sq.mt or 272.50 sq. ft carpet area and 26.63 sq.mt or 286.54 sq.ft Buildup area and 50.65 sq.mt or 545 sq.ft super buildup area with 6.72 sq.mt share in land bearing shop no. G-39, situated at R.S No.580/1, 592/1, 593, 595, Block No.631. 671/B, T.P.S.No.12(Puna), F.P.No.24/1, 24/2 & 45/2, International Fashion Market, Ground Floor, Opp. Raj Mahal A/C Mall, Punagam Road, Puna, Tal. Surat City, Dist. Surat standing in the name of Mr.Ramnarayan Ambalal Tailor. Boundaries: North of: Passage and Open Space, South of: O.T.S, East of: Shop No.G-40 West of: Shop No.G-38

For detailed terms and conditions of the sale, please refer to the link provided in secured creditors website (www.tmb.in) Authorised Officer Place: Ringroad, Surat. **Tamilnad Mercantile Bank Ltd**

(For Ringroad Branch)

HLE GLASCOAT LIMITED Regd. Office: H-106, GIDC Estate, Vitthal Udyognagar, Anand, Gujarat - 388121.

(CIN: L26100GJ1991PLC016173)

Website: www.hleglascoat.com; Email ID: share@hleglascoat.com; Telephone: (02692) 236842 to 236845

NOTICE

33RD ANNUAL GENERAL MEETING & BOOK CLOSURE DATES

Notice is hereby given that the 33rd Annual General Meeting of the Company will be held on Thursday, 26th September,

2024 at 11:00 a.m. IST through Video Conferencing ("VC")/ Other Audio-Visual Means ("OAVM") to transact the business, as set out in the Notice of the AGM. The Ministry of Corporate Affairs (MCA) vide its Circular No. 9/2023 dated September 25, 2023 which is in

continuation to the Circulars No.10/2022 dated December 28, 2022, Circular No. 02/2022 dated May 05, 2022. Circular No. 21/2021 dated December 14, 2021, Circular No.02/2021 dated January 13, 2021, read with Circular no. 20 dated May 5, 2020, No. 14 dated April 8, 2020 and No. 17 dated April 13, 2020 (including other applicable circular(s) and SEBI Circular No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 dated October 7, 2023 read with Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 15th January, 2021 and SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020 permitted the holding of Annual General Meeting through Video Conference (VC) or Other Audio-Visual Means (OAVM) without the physical presence of Members at a common venue. In compliance with these Circulars and the relevant provisions of the Companies Act, 2013 and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Annual General Meeting of the Members of the Company is being held through VC/ OAVM only. The proceedings of the AGM will be deemed to be conducted at the Registered Office of the Company which shall be the deemed Venue of the AGM. Members attending the Meeting through VC/ OAVM shall be counted for the purposes of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013. The instructions for attending the AGM through VC/ OAVM are provided in the Notice of the

The Company is pleased to provide its Members the facility of casting votes using an e-voting system ("remote e-voting"), through the e-voting services provided by Link Intime India Private Limited (LIIPL). Additionally, the Company is providing the facility of voting through e–voting system during the AGM ("e–voting"). The Members who have casted their vote by remote e–voting may also participate in the AGM, but shall not be entitled to cast their vote $again. The \, detailed \, procedure \, for \, remote \, e-voting \, and \, e-voting \, during \, the \, AGM \, is \, provided \, in \, the \, Notice \, of \, AGM.$

The remote e–voting period begins on Monday, 23 $^{\circ}$ September, 2024 at 09:00 a.m. IST and ends on Wednesday, 25 $^{\circ}$ September, 2024 at 5:00 p.m. IST. The Members of the Company, holding shares as at the cut-off date of Thursday, 19th September, 2024 may cast their vote by e-voting. Any member, who has acquired shares of the Company and becomes member of the Company after dispatch of the Notice of AGM and holding shares as on Thursday, 19 $^{
m t}$ September, 2024, may obtain the login id and password by sending request at vadodara@linkintime.co.in . The remote e-voting module shall be disabled by Link Intime India Private Limited (LIIPL) for voting after 25° September,

Voting rights will be reckoned on the shares registered in the name of the members as on 19th September, 2024 (cut-off

In compliance with the aforesaid MCA Circulars and SEBI Circular, Notice of the Annual General Meeting along with the Annual Report for the financial year 2023-24 has been sent only by electronic mode to those Members whose email addresses are registered with the Company/RTA/ Depositories. Members may note that the Notice and Annual Report will also be available on the Company's website www.hleglascoat.com, website of stock exchanges i.e. BSE at www.bseindia.com, NSE at www.nseindia.com and website of LIIPL: https://instavote.linkintime.co.in

In case you have any queries or issues regarding e-voting, please refer the Frequently Asked Questions ("FAQs") and Instavote e-Voting manual available at https://instavote.linkintime.co.in, under Help section or write an email to enotices@linkintime.co.in or Call us:-Tel: 022-49186000.

Notice is also hereby given that the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Friday, 20th September, 2024 to Thursday, 26th September, 2024 (both days Inclusive).

Members who hold shares in physical form may also register/ update their Bank Account details for receiving the Dividend, if any, directly in their Bank Accounts through electronic mode or National Electronic Clearing Services (NECS) at the aforesaid link or can send an email, mentioning the Folio No. to the RTA of the Company by attaching copy of their cancelled cheque leaf or self-attested copy of front page of bank passbook.

. Members may note that in terms of the Income Tax Act. 1961, as amended by the Finance Act. 2020, dividend income will be taxable in the hands of shareholders w.e.f. April 01, 2020 and the Company is required to deduct Tax at Source at the prescribed rates on dividend payable to shareholders.

Tax Deducted at Source (TDS) on Dividend:

Date: 04.09.2024

Place: Anand

Members not liable to pay income tax need to submit a declaration to avail the benefit of non-deduction of tax at source by uploading the declaration together with relevant documents on the link https://www.linkintime.co.in/formsreg/submission-of-form-15g- 15h.html on or before September 19, 2024. Members may refer to the notice of the AGM for detailed instructions in this regard.

For HLE Glascoat Limited

Achal S. Thakkar **Company Secretary & Compliance Officer**

Place: Samroli

મુંબઈ એરપોર્ટ પર

AI એક્સપ્રેસ કાઉન્ટર સ્ટાફ પર મહિલા પેસેન્જરે હુમલો કર્યો

એક્સપ્રેસ) કાઉન્ટર પર એક મહિલા પેસેન્જરે મહિલા સ્ટાફ પર હુમલો કર્યો. એર ઈન્ડિયા

હતું." આ પછી મહિલા મુસાફરને પોલીસને હવાલે કરવામાં આવી હતી. મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસ કાઉન્ટર પર એક

વર્ષ દરમ્યાન મંડળ ચેરીટીનું કામ

ફન્ડના અભાવ ચેરીટીનું કામઅટકી

ગયું હતું ત્યારે અનંત અંબાણીએ

મંડળને સારો એવો

સપોર્ટ કર્યો હતો.

સમયે મંડળને ૨૪

ડાયાલીસીસ

કાઉન્ડેશને

લાલબાગ ચા રાજાના દરબારમાં

આવતો હોય છે. ગયા વર્ષે તો

લાલબાર્ગ ચા રાજાના મંડળની

આસપાસ અનંત અંબાણીના

નામના બેનર્સ પણ લગાવવામાં





અમારા ગ્રાઉન્ડ ઓપરેશન પાર્ટનરના સ્ટાફ મેમ્બર સાથે ખરાબ વર્તન કર્યું હતું." જ્રુટી મે ને જરે તરત

કર્મચારી અનુરાધા રાનીને કસ્ટડીમાં લીધી હતી. **VEHICLE FOR SALE** ASHOK LEYLAND LTD. Ashok Leyland 1618 1c Cabin and Chassis-2019 Reg.No.: GJ-01 HT5482



એક્સપ્રેસના પ્રવક્તાઃ ુંગળવારે એક નિવેદનમાં ″ાળધ્યેબરના મહિલા મુસાફરે મહિલા સ્ટાફ પર હુમલો કર્યો હતો. આ જોઈને જણાવ્યું હતું કે, "૧ સપ્ટેમ્બરના રોજ, એક મહિલા પેસેન્જરે મુંબઈ એ્રપોર્ટ પર અમારા ગ્રાઉન્ડ સ્થળ પર અકરાતકરી મચી ગઈ હતી. આ પછી, ડ્યુટી મેનેજર ઘટનાસ્થળે પહોંચ્યા અને ઓ પરેશન પાર્ટનરના સ્ટાર્કમહિલાને પોલીસને હવાલે કરી.

મુંબઇના વિખ્યાત 'લાલબાગ ચા રાજા' ગણેશોત્સવમાં અનંત અંબાણીની એન્ટ્રી

મુંબઇ: વર્ષોથી લાલબાગ ચા ગણેશોત્સવ દરમ્યાન જે પૈણે રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ ડોનેશન આવે છે એમાંથી આખા સાથે જોડાયેલા અનંત અંબાણીને મુંબઇના આ નંબરવન ગણેશોત્સવ કરે છે. જો કે લોકડાઉનના સમયે મંડળે ઓ નરરી

મેમ્બર બનાવી દીધો છે. તાજેતરમાં યોજાયેલી મંડળની વાર્ષિક સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

એન્યઅલ જનરલ ડ દ્વારા સાંસ મશીન આપ્યા હતા તેમજ મંડળની રુગ્ણ સહાય નિધિ યોજનામાં પણ અનંત અંબાણીએ મદદ કરી હતી. મકવામાં આવ્યો હતો જેને દર વર્ષે અંબાણી પરિવાર હતો. મંડળના એક સભ્યે કહ્યું હતું કે એજીએમમાં લેવાયેલા નિર્ણય મુજબ કમિટિએ અનંત અંબાણીને ઓનરરી મેમ્મબરશીપ આપવાના નિર્ણય પર મંજુરીની મહોર મારી દીધી છે. દર વર્ષે નજરલ બોર્ડની મંજુરી સાથે આ મેમ્બરશીપની

કર્ણાટકમાં મચ્છરનું પ્રજનન રોકવા સહિતના ઉપાયો ફરજિયાતઃ નિયમ ભંગ બદલ ભારે દંડ

મુદ્દત વધારી શકાશે.

બેંગ્લર તા.૪ કર્ણાટકમાં વધતા જતા ડેંગ્યના કેસના કારણે સરકારે ડેંગ્યને મહામારી જાહેર કરી છે. ડેંગ્યુના કહેરના કારણે સિધ્ધા રમૈયા સરકાર પણ એકશન મોડમાં આવી ગઈ છે આ ઉપરાંત મચ્છરોની ઉત્પત્તિ-પ્રજનન રોકવામાં નિષ્ફળ જનાર લોકોને દંડ ફટકારવાના નિર્દેશ સરકારે આપ્યાં છે.

સરકારે કર્ણાટક મહામારી રોગ વિનિયમન ૨૦૨૦માં સંશોધન પણ રજૂ કર્યું છે. જેમાં લોકોને વેકટરજનિત રોગના પ્રસારને રોકવા વધુ જવાબદાર થવાનો આદેશ આપ્યો છે. જે લોકો નિયમનું પાલન કરવામાં અને મચ્છરોના પ્રજનન રોકવામાં વિફળ રહે છે તેના પર કાર્યવાહી કરવામાં આવશે

હિમાચલમાં પક્ષપલ્ટો કરનાર ધારાસભ્ય પેન્શન ગુમાવશે

સીમલા, તા.૪ દેશમાં ધારાસભ્યો અને સાંસદોના મક્ષપલ્ટા સતત વધી રહ્યા છે. તે સમયે હિમાચલ સરકારે એક મહત્વના નિર્ણયમ પક્ષપલ્ટો કરનાર ધારાસભ્યોને પેન્શન નહીં મળે તેવો કાનુન વિધાનસભામાં પસાર કરાવતા રાજ્યમાં રાજકીય રીતે અસ્થીરતા સામે એક વિઘ્ન ઉભું કરવા પ્રયાસ કર્યો છે. હાલમાં કોંગ્રેસના છ મ્યોએ બળવો કરીને ભાજપમ નાતાતભ્યાઅ બળવા કરાને ભાજપમાં જોડાયા છે. મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુએ વિધાનસભામાં ધારાસભ્યોના પુન્શન અને ભથ્યા સુધારા ખરડો રજુ કર્યો હતો અને તેના પર ચર્ચા બાદ મંજુરી મળશે. જો કે રાજ્યપાલ આ ખરડો મંજૂર મળશ. જો કરોજપાલી આ ખરડા મહુવ કરે તો જ તે કાનુન બનશે. રાજ્યમાં કોંગ્રેસના ૪૦ અને ભાજપના ૨૮ ધારાસભ્યો છે. લોક્સભા ચૂંગણી અગાઉ અહીં કોંગ્રેસ સરકારને અચ્ચિર કરવા ભાજપે પ્રયાસ કર્યા છે પણ તે નવ્ય નિવડયા છે. રાજ્ય સરકારે કહ્યું કે પક્ષપલ્ટાના કારણે વારંવાર રાજકીય અસ્થિરતા સર્જાઇ છે અને ધારાસભ્ય ોતાના લાભ માટે પક્ષપલ્ટો કરે છે.

મનજર તરત જ સીઆઈએસએકને જાણ કરી અ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ મહિલા પેસેન્જરને પોલીસને હવાલે કરવામાં આવી.તમને જણાવી દઈએ કે થોડા મહિનાઓ પહેલા સ્પાઈસજેટ એરલાઈન્સની એક મહિલા કર્મચારીએ જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એરપોર્ટ સુરક્ષા પર તૈનાત સીઆઈએસએફ જવાનને થપ્પડ મારી હતી.

CISF જવાને કહ્યું કે એરલાઇનની મહિલા સ્ટાફ જયારે તલાશી લીધા વિના વાહનના ગેટમાં બળજબરીથી પ્રવેશવાની ના પાડી ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા. આ પછી તે ઉતાવળમાં આવ્યો અને સીઆઈ ગિરિરાજ પ્રસાદ પર હાથ ઉપાડ્યો. આ પછી પીડિત સીઆઈએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરી. ત્યારબાદ પોલીસે આરોપી મહિલા

INDUSIND BANK 9879624100

USHANTI COLOUR CHEM LIMITED

Registered Office : 88/8, GIDC Phase I, Vatva, d - 382445, Gujarat, India. Tel. No.: 079-258333

tice is hereby given that the 31° Annual General Meeting (AGM) of the Members o hanti Colour Chem Limited ("the Company") will be held on Saturdey, 28° September 24 at 11:90 AM 15 ar registered Girco of the Company situated at 888, GIDC, Phas fetve, Ahmedebad-382445, Gujarat, India in physical mode to transact the businesse

art to Section IVI of the Act read with field is of the Companies (Management and Estestion) Rales, 2014, Regulation 36 of the Using Regulations, Socretarial and on Gineral Meetings (SS 27) and in compliance with the MCA Circleser and SSE! or, the Metics of 37 Act Metings with the Annual Report 2022-24 have been sensity of Section 2022-24 have been sensity of the Companies (Management and Section 2022-24 have been sensity of the Companies (Management and Section 2022-24 have been sensity of the Companies (Management and Section 2022-24 have been sensity of the Companies (Management and Section 2022-24 have been sensity of the Section 2022-24 have been sensity of

Minku Shantilal Gandhi Joint Managing Director - DIN – 00118617



દેશના ઉત્તર પૂર્વના રાજ્યોમાં મેઘ કહેર થમવાનું નામ નથી લેતો ાગાલેન્ડમાં ભારે વરસાદના કારણે યપોકેદીમાં જીલ્લામાં કોહિયા અને િદયાપુરને જોડતા નેશનલ હાઇવે પર થયેલા ભૂસ્ખલનમાં ૩ લોકોના મોત થયા હતા ભૂસ્ખનના કારણે હાઇવેનો કેટલોક ભાગ તેમજ મકાનો ક્ષતિગ્રસ્ત થયેલા નજરે પડે છે.

તા.૯ના રોજ જીએસટી કાઉન્સિલની બેઠક ટેક્સ અને સેસ પર વિચારણા થશે

નવા દિલ્હો, તા. જ જીએસટી ઉઘરાણી એંગે નોટીસ આપવામાં આગામી તા.૯ના રોજ જીએસટી આવી છે તેમાં તેમને રાહત એંગે નિર્ણય કાઉન્સીલની મળવારી બેક્સમાં એક તરફ લેવાશે. રાહ્યમને જે જીવન

રાજ્યને જે વળતર ચૂકવાય છે તે સંદર્ભમાં નિર્ણય લેવાશે અને માનવામાં આવે છે કે કે અન્ય કોઈ સેસમાં વધારો કરવામાં આવશે. ટકા છે તે વધારીને ૨૮ ટકા સુધી લઈ પદ હેઠળ મળનારી આ બેઠક કેટલાક કેન્દ્ર સરકારે રાજ્યને જીએસટી

પ્રકારે નોટીસ આપી છે. આ ઉપરાંત કમ્પનસેસન વધુ એક વર્ષ ચાલુ રહેશું અને કાઉન્સીલની બેઠકમાં કર અને ટુ-ન્દીલરની જો તે રદ કરવી હોય તો તેના બદલે ટેક્સ સીટ પરના જીએસટી કે જે હાલ અડધા थवाय तो तेवी शस्पता नक्षराती न<u>धी</u>. ઉત્પાદનો પરના જીએસટી અંગે પણ ચુક્વવા જે રૂ.૧.૫૯ લાખ કરોડની લોન વિચારણા થશે આ ઉપરાંત વિદેશી ઉભી કરી છે તેમાં હાલ રૂ.૧.૨૫ લાખ એરલાઇન્સને રૂ.૧૦ હજાર કરોડની કરોડની રકમ બાકી છે.

Kiri Industries Limited

re Full of Color

(CIN-L24231GJ1998PLC034094) :: ૭મો માળ, તસુભાઈ ચેમ્બર્સ, ટાઉનહોલ સામે, એલિસહિજ : (પી.) +૯૧ ૭૯ - ૨૧૫૭૪૪૩૭૧/૭૨/૭૩, ફેક્સ: +૯૧ ૭ ઈલ આઈ.ઊ. indskirindustries.com: વેબસાઈટ: www.kininc

ર દમી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે કીરી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સભ્યોની રદ્દમી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) શુક્રવાર, સપ્ટેમ્બર ૨૭, ૨૦૨૪ના રોજસવારે ૧૧:૦૦ વાગે, કંપનીધારા, ૨૦૧૩ની જોગવાઈના પાલન અર્થે અને ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય (એમસીએ)ના મામાન્ય પરિપત્ર ક્રમાંક ૧૪/૨૦૨૦. ૧૭/૨૦૨૦. ૨૦/૨૦૨૦. ૦૨ ૨૦૨૧, ૨૧/૨૦૨૧, ૦૨/૨૦૨૨, ૧૦/૨૦૨૨ અને ૦૯/૨૦૨૭ તથા સેબી પરિપત્ર ક્રમાંક SEBI/HO/CED/CMD1/CIB/P/2020/79. SEBI HO/CFD/CMD2/CIR/P/2021/11, SEBI/HO/CFD/CMD2/CIR/F 2022/62, SEBI/HO/CFD/POD-2/P/CIR/2023/4 અને SEBI/HO/ CFD/CFD-POD2/P/CIR/2023/167 (હવે પછી સંયુક્ત રીતે પરિપત્રો તરીકે ઉલ્લેખ થશે) સાથે વંચાણે લેવામાં આવતા ધ સેબી (લિસ્ટિંગ ઓલ્લીગે શન્સ એન્ડ ડીસ્ક્લોઝર રીક્લાયરમેન્ટ્સ) રેગ્યલે શન ૨૦૧૫ (લિસ્ટિંગ રેગ્યુલેશન)નું અનુપાલન કરતાં વીડિયો કોન્ફરન્સ (V/C)ની સુવિધા મારફત એજીએમની નોટીસમાં જણાવેલા કામકાજ કરવા માટે યોજવામાં આવશે

ઉપરોક્ત પરીપત્રો અને લીસ્ટીંગ રેગ્યુલેશન્સ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટેના વાર્ષિક અહેવાલની સાથે એજીએમની નોટીસ ઈલેક્ટ્રોનિક મોડ મારફત જે શેરધારકોના ઈમેઈલ એડ્રેસ ઓગસ્ટ ૩૦ ૨૦૨૪, શુક્રવારના રોજ કંપની/ ડીપોઝીટરી પાસે નોંધાયેલ હશે તેઓને સપ્ટેમ્બર ૦૪, ૨૦૨૪ના રોજ મોકલી આપવામાં આવેલ છે રદ્દમી એજીએમની નોટીસ સાથે વર્ષ ૨૦૨૩-૨૪ માટેનો વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ <u>www.kiriindustries.com,</u> સ્ટોક એ ક્સચેન્જની વેબસાઇટ <u>www.bseindia.com</u> અને <u>www.nseindia.com</u>, તથા સેંટ્રલ ડીપોઝીટરી સર્વિસીસ ઈન્ડિયા લીમીટેડ (સીડીએસએલ)ની વેબસાઇટ <u>www.evotingindia.com</u>

ધ કંપનીઝ (મેનેજમેંટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ સાથે વંચાણે લેવામાં આવતા કંપની ધારાની કેલમ ૯૧ અને લીસ્ટીંગ રેગ્યુલેશન્સના રેગ્યુલેશન ૪૨ના અનુસંધાને , કંપનીના સભ્યોનું રજીસ્ટર બને શેર ટ્રાન્સફર બૂક એજીએમના હેતુસર શનિવાર, સપ્ટેમ્બર ૨૧ ૨૦૨૪થી શુક્રવાર, સપ્ટેમ્બર ૨૭, ૨૦૨૪ (બંને દિવસો સમાવિષ્ટ)સુધી બંધરહેશે અને રીમોટઇ-વોટિંગ અથવા સભા દરમિયાન ઇ-વોટિંગ મારફત મત આપવા માટેની પાત્રતા નક્કી કરવા માટે કટ ઑફ તારીખ શુક્રવાર, સપ્ટેમ્બર ૨૦, ૨૦૨૪ છે.

. કંપની ધારાની કલમ ૧૦૮ અને તે હેઠળ બનાવવામાં આવેલા નિયમ ાનસાર. ફક્ત ઈલેક્ટોનિક માધ્યમો દ્વારા મતદાન મારફત જ સર્વ કામકાજ કરવામાં આવશે. કટ-ઑફ તારીખે શેર ધારણ કરનાર સભ્યો માટે રીમોટ ઇ-વોટિંગ નો પ્રારંભ મંગળવાર, સપ્ટેમ્બર ૨૪, ૨૦૨૪ના રોજ સવારે ૯-૦૦ ક. (ભારતીય સમય)એ થશે અને ગુરૂવાર, સપ્ટેમ્બર, ૨૬, ૨૦૨૪ના રોજ સાંજના ૫-૦૦ ક. (ભારતીય સમય)એ સમાર થશે . (૩૫૨) ક્ત તારીખ અને સમય પછી રીમોટ ઇ-વોટિંગ કરવા દેવામાં આવશે નહીં. એજીએમ દરમિયાન ઇ-વોટિંગ માટેની સૂચનાઓ એજીએમની નોટીસમાં આપવામાં આવેલી છે. રીમોટ ઇ-વોટિંગ મારફત મતાધિકારનો ઉપયોગ કરનાર સભ્યો એજીએમમાં ઉપસ્થિત રહી શકશે તથા ભાગ લઈ શકશે પરંતુ એજીએમ દરમિયાન ફરી મત આપી શકશે નહીં. નોટીસ મોકલવામાં આવ્યા પછી જેમને શેર પ્રાપ્ત કરેલ છે અને કટ-ઑફ તારીખે શેર ધારણ કરેલ છે તેવી વ્યક્તિઓ helpdesk.evoting@cdslindia.com ને વિનંતી મોકલીને લોગ ઇન વિગતો પ્રાપ્ત કરીને તેઓનો મત આપી શકશે. ઇ-વોટિંગ માટે અને લોગ ઇનની પદ્ધતિ માટે તથા વર્ચ્યુયલ સભામાં જોડાવા માટેની સુચનાઓ એજીએમની નોટીસમાં આપવામાં આવેલી છે.

ઇ-વોટિંગ પ્રક્રિયાનું ન્યાયી અને પારદર્શક રીતે નિરીક્ષણ કરવા માટે ખાર.ટી.બી.આર. એન્ડ એસોસીએટસ. પ્રેક્ટિસીંગ કંપની સેક્રેટરીસની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ઇ-વોટિંગ સંબંધિત કોઈપણ પૂછપરછ માટે, શેરધારકો www.evotingindia.com પર હેલ્પ વિભાગમાં પ્રાપ્ય એફએક્ચ અને મેનેજર, સીડીએસએલ, એ વિંગ, ૨૫મો માળ, મેરેથોન ફયચરેક્સ મફતલાલ મીલ કમ્પાઉન્ડ, એન એમ જોશી માર્ગ, લોઅર પરેલ (પૂર્વ) મુંબઈ-૪૦૦૦૧૩, ઇ-મેઈલઃ <u>helpdesk.evoting@cdslindia</u> પર સંપર્ક કરી શકે છે અથવા ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૨ ૫૫ ૩૩ ૫૨ કોલ કરી શકે છે

કીરી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ વતી તારીખઃ સપ્ટેમ્બર ૦૫ , ૨૦૨૪ સ્થળઃ અમદાવાદ સરેશ ગોંડલીયા ુ કંપની સેક્રેટરી

ઓનલાઇન કોર્સ કરવા માટે UGC -DEB પોર્ટલમાં નોંધણી કરવી ફરજીયાત

નવી દિલ્હી.તા.૪ ઓનલાઈન અભ્યાસકમોમાં પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓએ પહેલાં UGC-DEB (ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યુરો) પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે. આ પાટલ પર નાધણાં કરાવલાં પડશ. આ અંગે જારી કરાયેલી યુજ્સીની નોટિસમાં કહ્યામાં આવ્યું હતું કે કેટલીક ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અમાન્ય ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગ અને ઓનલાઈન કોર્સમાં વિદ્યાર્થીઓને આ પ્રકારની ઓનલાઈન ડિસ્ટી હોળ અપ્રકારની ઓનલાઈન ડિગ્રીનો લાભ મળતો નથી.

યુજીસીના ચેરમેન પ્રો. એમ. જગદીશ કહે છે કે જે રીતે રેગ્યુલર કોર્સમાં સ્ટાન્ડર્ડ પ્રક્રિયા અપનાવવામાં આવે છે તે જ રીતે ઓનલાઈન કોર્સની

આ સત્રમાં વધુ વિકલ્પો મળશે

DEB (ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યુરો) પોર્ટલ https:// deb.ugc.ac.in/ studentDebId પર નોંધણી

એડિમિશન પ્રક્રિયામાં પણ મહત્વના કેશ્માર કરવામાં આવ્યો છે. પ્રો. કુમારના - પ્રક્રિયા રોક્ષણિક સત્ર ૧૦૧૪ - ૧૫ જિલ્લાઓ જિલ્લાઓ કોઈપણ વિદ્યાર્થી જે થી લાગુ કરવામાં આવશે અને ઓનલાઈન અભ્યાસક્રમોમાં પ્રવેશ ઓક્ટોબરથી શરૂ થતાં નવાં સત્રમાં પ્રવેશ તેનાદ દરેક વિદ્યાર્થીએ આ પુનિષ્ઠ ID બનાવવાનું રહેશે. પ્રો . કુમારે કહ્યું કે આ સાથે UGC પાસે દરેક સંસ્થામાં ઓનલાઈન અભ્યાસક્રમનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની માહિતી હશે.

કરતા વિદ્યાર્થીઓના માહિતા હશે. આ સત્રમાં યુનિવર્સિટીઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સ માટે વધુ વિકલ્પો મળશે. ઓપન ઓનલાઈન કોર્સીસ પ્લેટફોર્મ સહિત IIT, IIM જેવી ટોચની શૈક્ષણિક કરવાની રહેશે. નોંધણી પછી, વિશાર્થીનું IIT, IIM જેવી ટોચની શૈક્ષણિક DEB-ID તૈયાર થઈ જશે. એકેડેમિક સંસ્થાઓમાં પણ ઓનલાઈન કોર્સીસનો બેંક ઓફ કેડિટ ABC-ID માંથી વિકલ્પ ઉપલબ્ધ હશે.

ઓમકાર ફાર્માકેમ લીમીટેડ

CIN: L93000GJ1995PLC025276 ઓફીસ: ૩૧૦, વોલ સ્ટ્રીટ-૧, ગુજરાત કોલેજ ચારસ્તા પાસે, એલીસલુજિ, અમદાવાદ-૩૮૦ ૦૦૬, ગુજરાત ફોલ: +91 971181163 E-mail: investors.opl@gmail.com Website: www.nmkarnbarmarch

રલ્મી એજીએમ, બુકક્લોઝર અને ઈ-વોટિંગની નોટિસ

પનીઝ એક્ટ, ૨૦૧૩ની કલમ ૧૦૮ અનુસાર તથા કંપનીઝ (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) બિયમો ૨૦૧૪ અને ર ભાનો સેકેટરીયલ સ્ટાન્ડર્ડ-૨ અને સેબી (લીસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડીસક્લોઝર રીક્લાયરમેન્ટસ) રેગ્યુલેશન

કંપનીજ એક્ટ, રુવાર-ગી કલામ પાર અણાવાર લાંક પંખીજ (બેન્જમેન્ટ અને લોકપિમિસ્ટ્રેશમાં) મિચામે રુવાર અને સામાન્ય ક્લામનો સેક્ટરીક્ય કરાન્કર્લ-- અને કેલો (લિક્ટી) ઓલીકોમ્યુ અને ક્લાક પ્રત્યુ કર્યા કર્યા કરાને કરાન્કર કરાનું કરાનું કરાનું સાથ કરવા (રિગી લિક્ટી) સેક્ટરીક્સ કરાન્કર કરાનું કરાનુ

િન્દિકા મોગીપરનો લગતા લોવા પ્રત્યો કે મૂકાઓ હોય તો ગેરાધારણે www.evolinglindia.com-ui .stilevidis સેશબન ખેં પાબલલં કીશન-લરી આરક્ક કહેલાન (એફએકોક્યુલેશ) અને ગેરાધારણે માટેના વિ-નોર્કિંગ સુરસ મેન્સૂબનનો સંદર્ભ લાં વાફે માવવા halpdesk-vorting(@dsilindia.com ને વી-મોલા કરી ગાં છે છે આવ્યા ટોલ છે નો. ૧૮૦૦ ર૧ બન્દવ વિપર થી રાઇ-દાલી, સીમીચાર મેનેપર, (સીડિએક્સ)લો, એ-નિંદા, રમમે માળા, મેરોમાં ન્હુલાર, મનલાલા લિંદ લંબીન્સ, એન. એમી મોગી માર્ગ, લેલાર પાર્ચલે (પૂર્વ), મુંભાં-અ૦૦૧૩ આવા હોમાં રીકેટરી આ અન્યાલાન્સ મોહિસનો વી-વિ-સાંચલ માર્ચકાર ભાગકારિકાર્યા, મારામાં મારામાં અન્યાલાના સ્થાન સ્થાન કર્યા હોય સ્થિત કર્યા હોય સ્થાન કર્યા હોય કર્યા હોય કર્યા હોય કર્યા હોય સ્થાન કર્યા હોય સ્થાન કર્યા હોય સ્થાન કર્યા હોય સ્થાન કર્યા હોય કર્

હેરો. બોર્ડના આદેશ દ્વાર ઓમકાર કામબિમ લિમિટેડ વર્તા, સ્થિતિ-ભવાની શંકર ગોધલ (એમ.ડી.) ડીલઃ કરપ્પદલ્ઝ સરનામુંદ ઘર તે પપણ, પહેલા મળે, ગલી નં. ર, ગુરૂહારા પાસે, ગોલિંદપુરી, કલકાજી - ૧૧૦૦૧૯ દિલ્લી

એચએલઈ ગ્લાસકોટ લિમીટેડ

CIN No.: 12610031991PtC016173 રજી. ઓફિસ: એચ.૧૦૬ - છુ.આઈ.ડી.સી. વિદ્વલ ઉલ્લોગનગર, આઇર, ગુપરાત - ૩૮૮૧૧૧. ફોન તં.: (૦૧૭૯૨) ૨૩૭૮૪૨ છિ ૨૩૭૮૪૫. વેબસાઇટ: પ્રાપ્તા heigascoat.com; ઈ-મેઇલ: share@hleglascoat.com ગો 된 근

33 મી વાર્ષિક સામાન્ય સભા ("એજીએમ") અને બુક ક્લોઝર તારીખ સાથી તોટીસ સાપવાર્ષ સાથે છે કે કંપનીના સભ્યોની 33 મી વાર્ષિક સામાના સભા ('સેજીએમ") નોટીસમાં જણાવ્યા મુજબ વ્યવસાવનો વ્યવસારકરવા મહે સુરુવારતા. રક્ર મી રાપ્ટેમ્બર ૨૨૨૪ ના રોજ સમારે ૧૧.૦૦ કલાકે વિક્રેમો કેન્ફ્સન્સિંગ('VC')/અન્ય સોકિયો વિઝ્યુસલ ઘ્યમ ("OAVM") દ્વારા યોજાશે

મહિલા કુલ્લા તા. ૨૮/૧૪/૨૦૧૨, નં. ૦૪/૨૦૧૨ તા. ૦૫/૦૫/૨૦૧૨, ૧૧/૨૦૧૧ તા ૧૪/૧૨/૨૦૧૧, ૦૮/૨૦૧૧ તા.૧.૪/૦૪/૨૦૧૧ અને ૨૯/૨૦૧૦ તા. ૦૫/૦૫/૨૦૨૦ સાધે સામાના પરિપાન ૧૪/૨૦૨ તા. ૦૮/૦૫/૨૦૨૦ તા ૦૫/૦૫/૨૦૨૦ તા ૦૫/૦૫/૨૦૧૦ તા. તા. ૧૩/૦૪/૨૦૨૦ ના સાતરાવાલ છે. તેમજ ફોલી અને તા સામાના પરિપાનો નં SEB/HO/CFD/CFD-PD-2/P/CR/2023/167 તા. ૧૩/૭૪/૨૦૨૦ ના સાતરવામાં છે, તેમજ રોબી અને તેના સમ્યાન્ય પરિષ્યાં ને SEB/HO/CFD/CFD-P00-2/P/CIR/2023/167 તા. અમેં ઓક્ટોલર ૨૦૨૩, SEB/HO/CFD/CMD2/CIR/P/2023/11 તા. ૧૫વા જાતકારો સ્વારક્ષારે ૨૦૨૧ તથા SEB/HO/CFD/CMD/CIR/P/2023/75 તા. ૧૫વો મેં ૨૦૨૦ હતા સામાન્ય માળાની એક ૧૪ વર્ષન વાર્શિક કર્યા કરિત VC/OMM દ્વારા એપ્ટરમેન કરવાનો મુંદ્રી સામેદ છે. કે. આતી સર્વિતિમાન, ૨૦૧૩ (*પરિતિમાન"), સેલે (શિલ્ટીન સાંપ્રતીસ્વારન અને કિલ્કોલ્ડેઝ કરિતામાન્યું) એપ્ટ્રોલમાન, ૨૦૫૧ (*સેલી લીકીને સ્વેતુલોલમાં, ૨૦૧૫) એક MCA પીપરમાંની સંભાવતો સં

લિન્ક ઉત્ત હોવે ઇનિક્રિયા પ્રાપિટ (UIPL) ની ઇ-વોટિંગ સેવાઓ દ્વારા ઇનાની તેના સભ્યોને ઇ-વોટિંગ (સિર્સ્ટમ ("રિયોદ ઇ-વોટિંગ") નો ઉપયોગ કરીને મતદાન કરવાની સુવિધા સાપતા આતં કહ્યુંબળે છે. વધુમાં કંધનો સેઝ્ડમેન દરભાન ઇ-વોટિંગ સિરસ્ટમ દ્વારા પોતાનો મત સપ્તમારા સભ્યો પણ સેઝ્ડમેમમાં ભાગ તા લેજ છે છે. પરંતુ તેઓ ફરીથી મતદાન કરવા હક્કાર સ્ટેલે નહી. સેઝ્ડમેમ દરભાન વિનોદ ઇ-વોટિંગ સત્તો ઇ-વોટિંગ મોર્ડની વિગલવાર પ્રક્રિયા સેઝ્ડમેમનાં નો ઢીંશમાં સાપાયમાં આવી છે.

રિમોર્ટ ઇ-લોટિઝની સ્વાપિ સોમવાર તા રાગી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોષ સ્વારે દેવ૦ (IST) કલાકે શરૂ થણે અને બુલવાર તા. રામ ની સપ્ટેમ્બર ૨૦૨૪ ના લોષ સાંજે આવે પાવ ૭ કલાકે (IST) સમ્માવ થશે. ગુલાર તા. ૧૯મી સપ્ટેમ્બર ૨૦૧૪ ની કર એક વાઉપ પ્રમાણ શેર ઘરલતા ઇપ્વન તમ્હામાં ઇન્લોકિસ અને પ્રતાનો માત્ર સાથી એકે. હોઇપણ સમ્માર પ્રજેઓનની તોટેસ મોહલા પાકી અંદનીના લેખ કહીની કંપનીન તમા સભ્યા ઇ-વાદગ ઢારા પાતાના મત આપા થકે છે. કોઇપણ સભ્ય અઝબનના નાટાસ માકલ્યા પછો ! હિય અને ગુરૂચાર તા. ૧૯મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ શેર ધરાવતા હોય તેઓ vadodara@linkin તથા પાસવર્ધ મેળવી શકે છે. રીમોટ ઇ-વોરિંગ મોક્યુલ બુધવાર તા. ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૪ ના બર

રુપાય, હા.૧ ન યા સાન્યન્ય, ૧૯૧૧ (૧૯ આફ કર) માર ૧૪ જાતાં સભાવાર તથાક પાજક ફેન્દ્રા તથા જતા તમાપાયા માટહારદાર હશા. એકલા KCU પીપ્યોં માટે સેનિયાની પાઝનાનું બાળના કરીને, વર્ષીક સમાપાય સભાવો નોટીસ અને પાણકોલ પારે ૧૯ ૩ જ માટેના વર્ષિયા ટ્રેસ્ટલા સ્થારે તે સભાવે જ પડિસ્ટ્રિટિંગ કર્યો કહારા મોડલામાં આવી સ્ટેલ છે કે જેમના ભીવિત સરખામાં કંપની, 'સારદીએ' સાથે નાંધાનેશ છે. આ નોંધા હતા થઈ કે તે સભાવે જ પડિસ્ટ્રિટેંગ કર્યા હતા કર્યા કર્યાની સ્ટેલનાઇટ પ્લામ્પ્રો માટી પડિસ્ટ્રેટેંગ સાથે બસાઇટ www.bscindia.com અને www.nscindia.com પર પણ ઉપલબ્ધ રહેશે.

સભાસદોની વૉટિંગ ની બાબતના કોઇપણ પ્રસ્તો/ખુલાસાઓ માટે Frequently Asked Questions (FAQs) અને ઇ-nttps://instavote.linkintime.co.in અથવા ટોલ ફ્રી નં. 022-49186000 પર સંપર્ક સાધવા વિનંતી enotices@linkintime.co.in પરઇ-મેઇલ કરીને પણ જાણકારી મેળવી શકે છે.

તાથી સુચિત કરવામાં આવે છે કે સભાસદોનુ રિજિસ્ટર અને શેર ટ્રાન્સફર બૂક્સ શુકવાર તા. ૨૦મી સપ્ટેમ્બર ૨૦૨૪ થી ગુરૂવાર તા. ૨૬મી તપ્ટેમ્બર ૨૦૨૪ (બંને દિવસ સહિત) બંધ રહેશે.

ત્વલ્લાન ૯ ૧૪ (પના દપતા ભાગ, ૧૫૫ રજા. કે જાઓ વીઠાફીના કરવા માં કેદ ઘરવાના હોય અને જે સભ્યો પોતાના ઈમેલ આઇડી, ટપાલ નું સાનાનું, ટેલીફોન, 'મોબાઇલ નંબર, પરમેનેન્ટ એકોઇન્ટર નંબર, વિક ખાતાની વિગતો અને નામાંકન નોધાવેલ નથી અથવા અપોટ કરવા ઇપડાના હોય તેઓરાં તેમના ક્રિપોટિસ્ટર પોટીસિપ્ટેટ (PD) સાથે ઉપરોક્ત વિગતે નોંધાવયા 'સંવતન કરાવવા વિનેતો અને ફ્રિકિકર રચૂપમાં શેર ઘરવાના સભ્યો, એ કંપની સથવા કંપનીના રસ્પિટ્ટાર અને શેર ફ્રાન્સફર એર્પેટ (સિંપે) એટલે કે લીકે ઇનકાઇના ઇન્ડિયા પ્રાપીચેદ લિમેટિસ, વાદેરાને જરૂરી દરતાવેખેર સાથે વ્યવસ્થિત તાક્ષરીત લાગુ પડતાં ઇન્વેસ્ટર સર્વિસ રિકવેસ્ટ (ISR) ફોર્મ જમા કરવા વિનંતી કરવામાં આવે છે.

પરોક્ત ઇન્વેસ્ટર સર્વિસ રિક્વેસ્ટ કોર્મે કંપનીની વેબસાઇટ www.hlegiascoat.com પર અને RTA વેબસ ttps://:www.linkintime.co.in પરઉપલબ્ધ છે. हेविड•ड पर डर डपात (TDS) :

નાણાં અધિનિયમ, ૨૦૨૦ દ્વારા સુધારેલ આવક વેરા કાયદા, ૧૯૬૧ ની શરતોમાં, કિવિકન્ડ આવક શેરધારકો ના હાથમાં તા. ૦૧, એપ્રિલ ૨૦૨૦ થી કરપાત્ર રહેશે અને કંપનીએ શેરધારકો ને કિવિકન્ડની સુકવણી નિર્ધારિત દરે કરની કપાત કર્યા બાદ કરવાની રહેશે.

સ્થાયક વેસ ભરવાયાત્રા ન હોય તેવા સભ્યોરો, https://linkintime.co.in/formsreg/submission-of-form-15g-15h.html ન લિંક પર સંબંધિત દરતાવેવો સથે સમ સંગેની જાયા હતા. ૧૯મી સપ્ટેમ્બર, ૨૦૨૪ ના કોજ સ્થયા એ પહેલ કરવાની રહેશે. સભાવો સ્કેપ્ટમેન, બુક લોગ્ન, તે નોંદીસ ગન્ની વિકિચ્ચ પર કરાબત કોનેની વિગ્લાવ સુધાના માટે સ્વેપ્ટમેનની નીસિટ લાગ્ને હવા કેને છે.

એય.એલ.ઈ. ગ્લાસકોટ લિમીટેડ સહી/–

એસ. ઠક્કા કંપની સેક્રેટરી અને કોમ્પ્લાયંસ ઓફિસ































